



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૧/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૧૬૩ લીટર દેશી દારૂ, ૪૧૫ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૨૪,૦૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૧/૧૯

આનંદનગર: ઉમાબહેન વા/ઓ દિવાકરભાઈ જોષી (ઉ.વ.૬૦) (રહે. કામેશ્વર એલીગન્સ, વંદેમાતરમ ચોક પાસે, ગોતા) એ તા.૧૧/૦૧/૧૯ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૪/૨૦૧૮ થી તા.૧૧/૦૧/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન સેટેલાઈટ પ્રેરણાતીર્થ દેરાસર રોડ રત્નદીપ કોમ્પલેક્ષ-૨ ફ્લેટ નં-બી-૨૦૪ ખાતે આરોપી મીનાક્ષીબહેન બાલુગીરી ગોસ્વામી (રહે.શ્રીધર કુટીર બંગ્લોઝ શિવપુજન ટેનામેન્ટની સામે, નિકોલ નરોડા રોડ) એ પોતાની માલીકીનો ફ્લેટ ઉમાબહેનને પી.જી. તરીકે ભાડે આપવાના બહાને ઉમાબહેનને વિશ્વાસમા લઈ રોકડ રૂપિયા અને BTGS મળી કુલ રૂપિયા ૨,૧૪,૫૦૦/- મેળવી લઈ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.કે.બારડ ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૨/૧૯

ઈસનપુર: ઇન્દ્રવન નગીનભાઈ પટેલ (ઉ.વ.૪૮)(રહે.મંગલમ સોસાયટી મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઘોડાસર) તા.૧૧/૦૧/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે ઈસનપુર નારોલ રોડ ગૌતમ ફર્નિચરની સામે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષે ઇન્દ્રવનભાઈની પીઠ પાછળ ભરાવેલ બેગ ઝુટવી લઈ નાસી ગયા હતા. બેગમાં રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- હતા. આ અંગેની ફરીયાદ ઇન્દ્રવન પટેલે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.ભરવાડ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૮૩/૧૯

વાસણા: સરોજબહેન વા/ઓ જીતેન્દ્રભાઈ યાદવ (ઉ.વ.૪૧) (રહે.શાંતાબાગ સોસાયટી વિશાલા હોટલ પાછળ વાસણા) તા.૧૦/૦૧/૨૦૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે ન્યુ વાસણા સિલ્વર ફ્લોરા ફ્લેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સરોજબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૨,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સરોજબહેન યાદવે વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી જોરસિંહ અમરસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૪/૧૯

નરોડા: પ્રહલાદભાઈ દેવજીભાઈ ચાવડા (ઉ.વ.૨૮) (રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી સેજલ પાર્કની બાજુમા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૧/૧૯ રાતના ૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના રહેણાંકના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી યોગેશભાઈ સેમ્યુલભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.